



# કામઘેનુ યુનિવર્સિટી

અમારું ધ્યેય: સર્વ જીવોનું કલ્યાણ

(ગુજરાત સરકાર દ્વારા સને ૨૦૦૯ના ગુજરાત અધિનિયમ ૯ હેઠળ પ્રસ્થાપિત)



## ઘોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કામઘેનુ યુનિવર્સિટી, ગાંધીનગર વ્હારા ચલાવવામાં આવતા

### સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩

કામઘેનુ યુનિવર્સિટીમાં ઘોરણ-૧૨માં વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ થયેલ તથા GUJCET-૨૦૨૨ પ્રવેશ પરીક્ષા આપેલ ઉમેદવારો માટે સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ધરાવતા, પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રવેશ અરજીફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટ <https://www.kamdhenuuniversity.net> પરથી તા.૦૪/૦૮/૨૦૨૨ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી તા.૨૬/૦૮/૨૦૨૨ના રોજ ૨૩:૫૯ દરમિયાન નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે ભરી શકાશે. ઉમેદવારો અરજી ફી પેટે રૂ.૨૦૦/- (નોન રીફંડેબલ) ઓનલાઈનના (ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ અથવા નેટ બેન્કીંગ) માધ્યમથી ભરવાની રહેશે. પ્રવેશ પ્રક્રીયા ઓનલાઈન/ઓફલાઈન ચોઈસબેઈઝ પદ્ધતીથી ચોજવામાં આવશે.

સદર અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રીયા અને તેના કાર્યક્રમ માટેની સંભવિત તારીખો સહિતની અદ્યતન માહિતી કામઘેનુ યુનિવર્સિટીની વેબસાઈટ <https://www.kamdhenuuniversity.net> પરથી મેળવી લેવાની રહેશે. પ્રવેશ કાર્યવાહી અંગેની કોઈપણ જાહેરાત હવે પછી દૈનિક સમાચારપત્રોમાં આપવામાં આવશે નહીં. જેની સૌ વાલી/ઉમેદવારોઓએ નોંધ લેવા વિનંતી.

ક્રમ	અભ્યાસક્રમોની વિગત	ગ્રુપ	અરજી ફી
૧	Bachelor of Technology (Dairy Technology) - [B. Tech. (DT)]	A or AB-Group	રૂ. ૨૦૦/-
૨	Bachelor of Veterinary Science & Animal Husbandry - (B.V.Sc. & A.H.) B or AB Group	B or AB-Group	રૂ. ૨૦૦/-
૩	Bachelor of Fisheries Science - (B.F.Sc.)	B or AB-Group	રૂ. ૨૦૦/-

### અગત્યની સુચનાઓ

- ઉક્ત દર્શાવેલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ચાલુ વર્ષની GUJCET-૨૦૨૨ પરીક્ષા ફરજિયાત આપેલ હોવી જરૂરી છે.
- ઉક્ત દર્શાવેલ અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકાઓ ઓનલાઈન યુનિવર્સિટીની વેબસાઈટ/એડમીશન પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે. માહિતી પુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- ઉમેદવારોએ અરજીફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ JPEG અથવા JPG ફોર્મેટમાં સ્કેન કરી પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
- ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારે હેલ્પ સેન્ટરની પસંદગી કરવાની રહે છે. ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ ચકાસણી (ઈ-વેરિફિંગ) પણ ઓનલાઈન જ કરવામાં આવશે. જેથી ઉમેદવારોએ હેલ્પ સેન્ટર ખાતે બોલાવવામાં ના આવે ત્યાં સુધી જવાની જરૂરિયાત નથી.
- ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની અગત્યની બાબતો તેમજ વખતો વખતની અન્ય વધુ માહિતી મેળવવા માટે યુનિવર્સિટીની વેબસાઈટ <https://www.kamdhenuuniversity.net> ના સતત સંપર્કમાં રહેવું.

**નોંધ: શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત સ્નાતક કક્ષાના ઉપરોક્ત દર્શાવેલ અભ્યાસક્રમો માટેની માહિતી પુસ્તિકામાં દર્શાવ્યા મુજબની સંસ્થાઓ માટેની પ્રવેશ કામગીરી કામઘેનુ યુનિવર્સિટી વ્હારા કરવામાં આવશે, તેથી આવા અભ્યાસક્રમો માટે મંજૂરી મળેલ ન હોય તેવી ખાનગી સંસ્થાઓ/યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતા પહેલા સંસ્થા અને અભ્યાસક્રમોની માન્યતા અંગેની ચકાસણી કરવા પૂરતી ડાળજી અને વિવેકબુદ્ધિથી નિર્ણય લેવા જણાવવામાં આવે છે.**

તા.૩૧/૦૭/૨૦૨૨ કુલસચિવ  
કામઘેનુ યુનિવર્સિટી, ગાંધીનગર